

#### April 13, 2024

To.

**Bombay Stock Exchange Limited** 

1<sup>st</sup> Floor, New Trading Ring, Rotunda Building, P. J. Tower, Dalal Street, Mumbai – 400 001.

Scrip Code: 533275

To,

National Stock Exchange of India Ltd.,

Exchange Plaza, C-1, Block G, BandraKurla Complex, Bandra (E), Mumbai – 400 051

Company Symbol: **SHAH** 

## SUB. : <u>Submission of copy of Advertisement of Corrigendum of Notice of Postal</u> Ballot.

With reference to above, we are enclosing copy of Advertisement of corrigendum for Notice of Postal Ballot published in Business Standard (English) and Jai Hind (Gujarati) on April 13, 2024 of Shah Metacorp Limited pursuant to relevant Regulation of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for your information and record please.

This is for your kind perusal and record. Kindly acknowledge the receipt of above.

Thanking you.

Yours faithfully, For, Shah Metacorp Limited (Formerly known as Gyscoal Alloys Limited)

Hiral Patel Company secretary and Compliance officer (Membership No. A56573)

Encl: As above

GICICI Home Finance | Corporate Office: ICICI Home Finance Company Limited ICICI HFC Tower, Andheri - Kurla Road, Andheri (East), Mumbai - 400059, India Branch Office: Plot No. 342, Ward-12/B, Office No. 203, 2nd floor, Rajkamal-2, Near Yes Bank, ICICI Bank, [See proviso to rule 8(6)]

Notice for sale of immovable assets

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the **Physical Possession** of which has been taken by the Authorized Officer of ICICI Home Finance Company Ltd., will be sold on "As is where is", "As is what is", and "Whatever there is", as per the brief particulars given hereunder;

Sr. No.	0 0	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Bhanu Pratap Singh (Borrower) Pooja Singh (Co-Borrower) Loan Account No. LHGDM00001373129 & LHGDM00001373130	Unit A, Plot No. 53 Paiki, South Side Part, Revenue Survey No. 772, Akshar Dham - 2, Village Varsamedi, Talukar Anjar, Dist Kachchh, Gujarat- 370110	Rs. 8,93,644/- April 05, 2024	Rs. 6,30,000/- Rs. 63,000/-	April 22, 2024 11:00 AM 03:00 PM	April 30, 2024 02:00 PM 03:00 PM

The online auction will be conducted on website (URL Link- https://BestAuctionDeal.com) of our auction agency GlobeTech. The Mortgagors/ notice are given a last chance to pay the total dues with further interest till April 29, 2024 before 5:00 PM else these secured assets will be sold as per above schedule.

The Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) RTGS/ Demand Draft (DD) (Reference of the Prospective Bidder(s) must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Money Deposit (EMD) (Reference of the Prospective Bidder(s) Must submit the Earnest Mone Column E) at ICICI Home Finance Company Limited, Plot No. 342, Ward-12/B, Office No. 203, 2nd floor, Rajkamal-2, Near Yes Bank, ICICI Bank, Gandhidham- 370201 or before April 29, 2024 before 04:00 PM. The Prospective Bidder(s) must also submit signed copy of Registration Form & Bid Terms and Conditions form at ICICI Home Finance Company Limited, Plot No. 342, Ward-12/B, Office No. 203, 2nd floor, Rajkamal-2, Near Yes Bank, ICICI Bank, Gandhidham- 370201 or before April 29, 2024 before 05:00 PM nest Money Deposit Demand Draft (DD) should be from a Nationalized/ Scheduled Bank in favoro "ICICI Home Finance Company Ltd.-Auction" payable at Kachchh.

For any further clarifications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact ICICI Home Finance Company Limited on 9920807300 or our Sales & Marketing Partner NexXen Solutions Private Limited.

The Authorized Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons. For detailed terms and conditions of the sale, please visit https://www.icicihfc.com

Date : April 13, 2024

**Authorized Officer ICICI Home Finance Company Limited** Place : Kachchh

# INVENT ASSETS SECURITISATION & INVENT RECONSTRUCTION PRIVATE LIMITED

Registered Office: Bakhtawar, Suite 'B', Ground Floor, Backbay Reclamation Scheme Block III, 229 Nariman Point, Mumbai – 400 021. Tel. No 022-22801516, Website: www.inventarc.com APPENDIX-IV-A [See proviso to rule 8r/w rule 9]

#### **SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**

PUBLIC NOTICE - AUCTION CUM SALE OF IMMOVABLE PROPERTIES ("SECURED ASSETS") OF MR. HARDIK ZINZUVADIYA ("BORROWER"), MR. MAYUR MARU ("BORROWER") AND MR. BHARAT DEVAYAKTA ("BORROWER") FOR THEIR DUES UNDER RULE 8 R/W RULE 9 OF THE SECURITY INTEREST ENFORCEMENT RULES, 2002.

Whereas, the Authorised Officer of **INVENT ASSETS SECURITISATION & RECONSTRUCTION PVT. LTD**. had taken physical possession of the following properties pursuant to the notice issued under section 13(2) of the 'Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act), in the following loan accounts with right to sell the same on "as is where is basis", "as is what is basis" and "no recourse basis" for realisation of Banks dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules proposes to realise the Bank's dues by sale of the said properties. The General Public is invited to bid either personally or through their duly authorised agent. The details of the auction cum sale are as follows: -

	òr o.	Name of the Borrower & Details of Property Mortgagor		Amount as per Demand Notice Demand Notice Date	Reserve Price EMD Bid Increase Amount	Last Date and Time Submission of Bids	Date/Time of Auction
	1	Hardik Zinzuvadiya	Residential Property at Jamna Complex, Flat No. 106, First Floor, Mukesh Park – 2, Street No. 5, National Highway, Rajkot-360002	contractual rate and other	Rs. 4,15,000/- Rs. 41,500/- Rs. 10,000/-	29.04.2024 11.00 AM	29.04.2024 12.00 PM
:	2	Mayurkumar Maru	House No. 245, Navin Nagar, Sr No. 75/3 Paiki 1, plot no. 5/C, Kuvadva Road, near Prince Residency Pipaliya Village, Rajkot - 360003.	June 2019 along with future interest as per	Rs. 3,10,000/- Rs. 31,000/- Rs. 10,000/-	29.04.2024 11.00 AM	29.04.2024 12.00 PM
3	3.	Bharat Devayakta  Residency, Nr Shapar June Village, Opp Khodal future Residency; Off pal pipallya road, at Pipaliya pal; Tal Leibite Builder Builder Palider		June 2019 along with future interest as per	Rs. 4,23,000/- Rs. 42,300/- Rs. 10,000/-	29.04.2024 11.00 AM	29.04.2024 12.00 PM

There are no known encumbrances on the Secured Assets. It shall be the sole responsibility of intending bidders to independently verify the area of the flat/premises and satisfy themselves with other details. Secured Creditors shall not be liable for any errors / omissions / discrepancy / shortfall etc. in the Secured Assets or for procuring any permission. etc. or for the dues of any authority established by law. For detailed terms and conditions of the sale, please refer to the link provided in www.inventarc.com Secured Creditor's website and for further details, contact Mr. Ankit Shetty Authorised Officer, Invent Asset Securitisation and Reconstruction Company Ltd. Phone No: 022-22801519, Mobile

No.: 9920587626, Email id: ankit.shetty@inventarc.com Date: April 12, 2024 Place: Mumbai

Authorised Office Invent Assets Securitisation & Reconstruction Pvt. Ltd.



SALE OF **IMMOVABLE PROPERTIES** 

Registered / Central Office: "Vasudhara Bhayan", Timaliyawad, Nanpura, Surat-395001

Phone: (0261) 2464621-24, Toll Free No: 1800 233 7722 | Email: info@spcbl.in | Website: www.spcbl.in SALE OF ASSETS IN POSSESSION OF BANK UNDER THE SECURITISATION & RECONSTRUCTION OF FINANCIAL ASSETS & ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 AND SECURITY INTEREST (ENFORCEMENT

RULES-2002.1 Offers are invited In sealed cover so as to reach the Authorized Officer on or before the commencement of auction for the sale of the following property in the Possession of the bank On "As is where is basis & whatever there is basis" towards the recovery of its secured debts with interest courts charges etc. from borrowers as stated here under.

Sr. No	Borrower / Guarantors Name	Secured Debt For Recovery
1	(1) M/s. Deep Creation Prop. Ansuyaben Maheshbhai Savaliya	As per demand notice dtd.
	Cash Credit A/c. No. 304013695082	25/06/2021 u/s. 13(2)
	Office : A-12 Sopariwala Estate Fatakda Vadi Ved Road Surat	Rs. 40.02.163/30 + Further

Varachha, Surat. Guarantors: (2) Maheshbhai Rameshbhai Savaliya

(3) Sanjaybhai Balabhai Vaghasiya **DESCRIPTION OF PROPERTIES** 

Contractual Interest and expence Resi.: B-160, Gopinathji Society Vibhag- 2, Lajamani Chowk, Mota thereon till the date of payment.

The below mentioned Flats of Radhe Residency, R. S.No.102/1 and 102/2, Block No.104 and 105, Plot No. 101 to 106 and Plot No. 123 to 128 of Shivam Residency, Moje Gaam- Kadodara, Taluka-Palsana, Dist. - Surat togethe with 7.15 Sq.Mt. undivided proportionate land bearing underneath the said Building, Owner of the Properties

Sr.No.	Flat No.	Builtup area ( Sq.Mt.)	Reserve Price(Rs.)	EMD(Rs.)
1	D/101, 1st Floor	28.25 SQ.MT	4,35,000/-	43,500/-
2	D/106, 1st Floor	28.25 SQ.MT	4,35,000/-	43,500/-
3	D/107, 1st Floor	27.97 SQ.MT	4,35,000/-	43,500/-
4	D/404, 4th Floor	29.37 SQ.MT	4,35,000/-	43,500/-
5	D/405, 4th Floor	28.16 SQ.MT	4.35.000/-	43,500/-

Date & Time of Auction: 29/04/2024, Monday @ 12:39 PM

Maheshbhai Rameshbhai Savaliya, Type Of Possession: Actual

Date & Time of Inspection: 19/04/2024 From - 03:00 PM to 04:00 PM

Note: Above mentioned properties are also mortgaged for other Term Loan Accounts (1) 304015436057 & (2) 304016003826 of The Surat People's Co-Op. Bank Ltd., APMC Branch.

Place of Auction:Board Room, 4th Floor, The Surat People's Co-op. Bank Ltd., Vasudhara Bhavan,

Timaliyawad, Nanpura, Surat- 395001

The offerers shall give offer for above properties in sealed cover and shall mention the address of property on offer cover with the EMD amount ( Earnest Money Deposit ) by means of Cheque/Demand Draft/RTGS/Online Transfel drawn in favour of "Authorized officer, The Surat People's Co-Op. Bank Ltd." payable at Surat should accompany with the offer which is refundable without interest if the bid is not successful. Offerers may remain present and revise thei offer upwards. On the confirmation of the sale the successful highest offerer should deposit 25% of the bidding amount on the spot and the balance 75% within 15 days, failing which the bank shall forfeit the entire amount already paid by the offerer without any notice.

Any Present and/or future statutory dues, Government dues, Salestax, Income tax, Vat dues, Commercial Tax dues G.S.T. Dues, Excise dues, Semi Govt. Dues, Labour dues, Provident Fund, Surat Municipal Corporation dues Taluka/Gram Panchayat dues, Property tax, Electricity dues, Maintenance dues and any other dues payable on above properties alongwith expenses for transfer shall have to be borne solely by the Purchaser. Any other dues/liabilities/charge other than this bank are not known to bank shall be solely paid and cleared by the purchaser. The cost, expenses stamp duty, additional stamp duty, registration charges incurred for the purpose o transfer of said properties shall be born solely by the purchaser. If Ashant dhara permission is require to transfer of said property, it should be obtain by purchaser with his cost. The purchaser shall get property transferred of its own and responsible to register the sale certificate in the sub registrar office in time. Bank shall deliver the available title document of properties to purchaser on "As is where is basis and whatever there is basis" only. The bank has no appointed or engaged any agent and/or broker for sale of the above mortgaged properties. For further inquiries contact Authorised Officer Shri Sunil R. Kapadia (Phone No.0261-2464593). Further enquiries, if any and/or terms and conditions for sale can be obtained from the Authorized Officer.

The Authorized Officer reserves its rights to reject any or all the offers received without assigning any reasons and to postpone the auction at any time. Sd/- Assistant General Manager & Authorized Officer Date: 09/04/2024

Place: Surat

The Surat People's Co-op. Bank Ltd.

्र बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda Ph: 0261-2409044, 2409045 ि विजया VIJAYA DENA

> POSSESSION NOTICE (For Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]

Whereas. The undersigned being the authorized officer of the Bank of Baroda under the while as, The undersigned being the authorized office of the bank of barous under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes: Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 06.01.2024 calling upon the borrower/guarantor Mr. Bhavesh Pravinkumar Makwan (Borrower) and Mr. Pravinbhai Mohanlal Makwana (Co-borrower) to repay the amour entioned in the notice Rs. 16,95,423.94/- (Rupees Sixteen Lakhs Ninety Five Thousan red Twenty Three and Ninty Four Paise only) unapplied interest from 05.10.2023 and legal & other charges within 60 days from the date of receipt of the said

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower an the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of **09th** day of April of the year 2024.

tag of April of the geal 2024. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda**, for an amount of **Rs. 16,95,423.94/-** unapplied interest from 05.10.2023 and legal & other

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY All those pieces and parcel the immovable property bearing RS No. 31 block No. 49 TPS NO. 66 FP no 47 located at plot no. flat no G2/403 SWEET HOME Opp. Shantiniketan Business Plaza. Amroli. Kosad road, Surat. Boundaries are: North: Building No.I G1, South: Flat NO G2/404, East: Open Land, West: Flat No. G-2/401.

Authorized Officer, Bank of Baroda. Date: 09/04/2024 Place : Surat Amroli Branch, Surat

PUBLIC NOTICE 16476 TO 16481 58728 . 70509 . 115649 . 153101 . 230592 8006160 , 50004462 , 50015069 wi distinctive no(s) 5602203 TO 5602209 1110912 TO 41110930 2747459 . 7264339 TO 7264373 . 1375617 TO 13756191 , 18264763 TO 18264783 22800683 TO 22800745 , 1250959 T 1250979 , 2057496 TO 2057510 , 375127 TO 3751283 for Equity shares No's. 208 ( (company name) PHILIPS INDIA LIMITEI with folio no. 0402815 standing in the ames of ANUPAMA RAMNIKI AI DOS AND JOINT NAME RAMNIKLA CHHAGANLAL DOSHI ( DECEASED) ha have been lost or mislaid and undersigne nas/have applied to the Company to issu duplicate Certificate(s) for the said shares Any person who has a claim in respect of th said shares should lodge such claim with th Company at its Registered address 3rd Floo Tower A, Dlf It Park, 08 Block , Af Majo Arterial Road, New Town (rajarhat), Kolkata 700156 within 15 days from this date els the Company will proceed to issue duplicat

Certificate(s).
Name(s) & Address of Applicant(s Anupama Ramniklal Dosh Lal Nivas, Khijda Street, Near Kishorsinh School, Diwanpara, Rajkot 360 001 Date :13/04/2024

STATE BANK OF INDIA

u/s 13(4) of SARFAESI Act 2002

Ist Floor, , Ratna Artemus, 42, Sardar Patel Nagar, Off C.G. Road, Ahmedabad-80006 E-mail: sbi.05181@sbi.co.in Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of power conferred on him / her under section 13(4) of the said Act read with 9 of the said Act on the dates mentioned against each account(s).

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property wil be subject to the charge of the **State Bank of India** for an amount and interest thereon The Borrowers attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available to redeem th

secured assets

Name of Account/ Borrower & address

Mr. Sanjay Ramnikbhai Singhadiya & Mrs. Khusbhu S Singhadiya

Bunglow No. 13 (Type A), Royal Bungalows, Opp. Shabri Bunglows, Nikol Road

Naroda Ahmedahad-382330 Mr. Sanjay Ramnikbhai Singhadiya & Mrs. Khusbhu S Singhadiya

Name of Proprietor/ Partners/ Guarantors/Owner of property etc.

Description of the property mortgaged / charged

All that Piece Or Parcel of Immovable Property Bearing House No. 13 Having Plot Area Admeasuring About 84 Sq.Mts. With Construction Thereon Ground floor And First Floor Admeasuring about 157 Sq. Yds. i.e 131.27.09 Sq.mts in the Scheme Known as Royal Bungalows Co-Operative Housing Society Ltd" On the Freehold Non Agricultural Residency use Land Bearing Sur. No. 344/A/1, T.P.S No. 101, Final Plot No. 18 Situated , Lying And Being at Mouje Nikol , Taluka Asarwa Of District Ahmedabad Of Sub-DistrictAhmedabad-12 (Nikol) and bounded as: East: House No. 14., West: House No. 12., North: House No. 10.South: Internal Road Date of Demand Notice: 17.04.2023 | Date of Possession: 10.04.2024 | Amount Outstanding: Rs. 61,79,570.00 as on 17.04.2023 plus interest on contractual rate, incidental charges, cost etc.

Date: 12.04.2024 State Bank of India, SARB, Ahmedabad



**Multi Commodity Exchange of India Limited** 

Exchange Square, CTS No. 255, Suren Road, Chakala, Andheri (East), Mumbai – 400 093. www.mcxindia.com

#### NOTICE

NOTICE is hereby given that following Members of Multi Commodity Exchange of India Ltd. (Exchange) have requested for surrender of their Membership of the Exchange:

Sr. No.	Name of the Member(s)	Member ID	SEBI Reg. No.	Timeline for Receiving Claims/ Complaints
1.	MNM Comtrade Private Limited	55275	INZ000294433	30 Days
2.	KLB Commodities Private Limited	31690	INZ000105134	60 Days
3.	Trade Winds Commodities & Derivatives Private Limited	16425	INZ000080237	60 Days

Any client(s)/constituent(s) of the above referred Members having any claim/dispute/complaint against these Members, arising out of the transactions executed on MCX platform, may lodge their claim within the timelines as provided in the above table, failing which, it shall be deemed that no claim exist against the above referred Members or such claim, if any, shall be deemed to have been waived. The complaints so lodged will be dealt with in accordance with the Bye-Laws, Rules and Business Rules of the Exchange.

The Client(s)/Constituent(s) may submit their claim on the online portal of the Exchange (https://igrs.mcxindia.com) or provide "Client Complaint Form" (available at www.mcxindia.com) in hard copy to Investor Services Department, Multi Commodity Exchange of India Ltd., Exchange Square, CTS No. 255, Suren Road, Chakala, Andheri (East), Mumbai - 400 093 or email it at grievance@mcxindia.com.

Upon surrender of Membership, the Authorised Person(s) (APs), if any, registered through these Members shall also cease to exist and therefore, such APs are not authorized henceforth to deal in

For Multi Commodity Exchange of India Ltd.

Place: Mumbai Date: April 12, 2024

Name of Account

Date : 13.04.2024, Place : Bhavnagar

respect of time available to redeem the secured assets.

Name of Proprietor/

Authorised Signatory - Membership Department

#### PUBLICATION OF NOTICE REGARDING PHYSICAL POSSESSION OF PROPERTY U/S 13(4) OF SARFAESI ACT 2002 SB STATE BANK OF INDIA Stressed Assets Recovery Branch (SARB) (18735): 2nd Floor, Administrative Office Building, Nilambaug Chowk

Bhavnagar, Gujarat - 364001. **Phone No.** 0278 - 2514051, **E-mail** : sbi.18735@sbi.co.in

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act. 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interes (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of power conferred on him / her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank Of India for an amount and interest thereon. The Borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act, in

Description of the

Date of

Date of

Authorised Officer, State Bank of India

Borrower & address	Partners/Guarantors/ Owner of property etc.	property mortgaged / charged	Demand Notice	Physical Possession	Outstanding Amount in Rs.
M/s. Jay Ambe Cotton Industries, Survey No. 99/1 Velavadar, Bhavnagar - Talaja Highway, Tal: Talaja, Dist: Bhavnagar, Gujarat - 364140	(1). M/s. Jay Ambe Cotton Industries, (2). Bharathhai Chitharbhai Rathod, (3). Bharathhai Devabhai Jograna, (4). Kishorbhai Bhaturbhai Dhameliya, (5). Nagjibhai Kuberbhai Kheni, (6). Pravinbhai Mohanbhai Dhameliya, (7). Jorubhai Bhagwanbhai Solanki, (8). Hansaben Kishorbhai Kukadiya, (9). Laxmanbhai Virabhai Parmar, (10). Devabhai Popathhai Jograna, (11). Harshaben Kishorbhai Dhameliya, (12). Rambhai Ravjibhai Kukadiya, (13). Bhartiben Pravinbhai Dhameliya, (14). Chetnaben Nareshbhai Kukadiya	All piece and parcel of immovable property bearing Plot No.7 Admeasuring: 599.01 Sq. Mts., situated at non-agri. land of s.no 253/2/3, at Vil. Vadava Tal. Bhavnagar with construction thereon Registered in the name of Devabhai Popatbhai Jograna.	25.08.2023	07.04.2024 (Physical Possession)	Rs. 9,24,49,762.59 (Rupees Nine Crore Twenty Four Lacs Forty Nine Thousand Seven Hundred Sixty Two and Fifty Nine Paisa Only) as on 25.08.2023
Mr. Dhanrajbhai Bhimshibhai Gadhavi and Mr. Bhagirath Dhanrajbhai Gadhavi, Plot No. 84, Survey No. 23, Shreeji Nagar, Nr. Shiv Township, Gundala Highway, Baroi, Mundra - 370421.	(1) Dhanraj Bhimshi Gadhvi (2) Bhagirath Dhanrajbhai Gadhavi	All the piece and parcel of Residential house at residential plot no. 8 4 admeasuring about 167.75 Sq Meters comprised in Revenue survey No. 23 Known as "Shreeji Nagar"	26.04.2023	07.04.2024 (Physical Possession)	Rs. 32,26,057.27 (Rupees Thirty Two Lacs Twenty Six thousands Fifty Seven and Twenty Seven Paise only) as on 25.04.2023
M/s. Bhagirath Footwear and Fashion Proprietor: Mr. Dhanrajbhai Bhimshibhai Gadhavi, Maheshnagar, Sheri No. 6, Baroi Road Mundra, Kutch - 370421.	(1) M/s Bhagirath Footwear and Fashion (Proprietor : Dhanrajbhai Bhimshibhai Gadhavi)	situated in Village- Baroi, Taluka-Mundra, District- Kutch Registered in the name of Dhanraj Bhimshi Gadhvi	26.04.2023	07.04.2024 (Physical Possession)	Rs. 5,83,266.60 (Rupees Five Lacs Eighty Three Thousands Two Hundred Sixty Six and Paise Sixty Only) as on 25.04.2023

यूनियन बैंक 🕼 Union Bank

Andhra asmittorer

Athwalines Branch, BSNL Doorsanchar bhavan, Karimabad, Ghod dod Road, Surat, Gujarat-395002 | Tel : 0261-2252403

Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002
POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the Authorized Officer of the Union Bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred inder section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement Rules. 2002 issued a demand notice dated **05/01/2023** calling upon th Borrower/Guarantor 1. Mrs. Geetaben Shambhubhai Nada (Borrower), 2. Mr. Chaturbhai Babubhai Gajera (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 29,31,506.51/- (Rupees Twenty Nine Lakh Thirty One housand Five Hundred Six and Fifty One Paisa Only) as on 31-12-2022 🗵 **Further interest and other Expenses** within 60 days from the date of receipt o

The Borrower/Guarantor having failed to repay the full amount notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest Enforcement Rules  $\,$  2002 on this the 11<sup>th</sup> Day of April of the year 2024.

The Borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India, Athwalines Branch for an amount of being Rs. 29,31,506.51/- (Rupees Twenty Nine Lakh Thirty One Thousand Five Hundred Six and Fifty One Paisa Only) as on 31/12/2022 and future Interest & Expenses thereon.

The Borrower's attention is invited to the provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of immovable property

The immovable property bearing Plot No: 20, admeasuring 61.78 sq.mtrs together with undivided proportionate share in to the land of non-agricultural residential society known as "Kailash Row House" that lying and being situated in Revenue Block Nos: 123, 124, 125, 126, 127, 135, 136 after Consolidation Block No: 123 of Village: Velania, Sub-Di: Kamrei, Di: Surat,

Date : 11/04/2024 | Place : Surat

Union Bank Of India

IDFC FIRST

Tarsadi Branch : Shop No 1 & 2 यूनियन बैंक 🜘 Union Bank

Op Mahavir.Apartment, Jalaram Chowkdi

Tarsadi, Mangrol, Surat E-mail :ubin0930083@unionbankofindia.bank

POSSESSION NOTICE [Rule-8(1)]

The undersigned being the Authorized officer of Union Bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcemen Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security interest (Enforcement Rules, 2002 issued a demand notice dated 05/01/2024 calling upon the Rules, 2002 issued a demand notice dated 05/01/2024 calling upon the Borrowers/Guarantor/Mortgagor namely, Mr. Jagmal Bhimabhai Bheda (Borrower & Mortgagor), Mr. Hareshbhai Bhimabhai Bheda (Co-Borrower & Mortgagor) And Mr. Rameshbhai Himmatbhai Labdiya (Guarantor) to repay the amount mentioned in the notice being Rs 9,16,833.16/- (Rupees Nine Lacs Sixteen Thousand Eight Hundred Thirty Three and Paise Sixteen Only) with interest within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor/ Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/ Mortgagor and the public in general that the undersigned has taken symbolic possession of the property described begrein below in exercise of nowers conferred on him under subsection (4) of

herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest Enforcement Rules,

2002 on this the 10th day of April of the year 2024.

The Borrower/ Guarantor/ Mortgagor in particular and the public in general is herebycautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India, Tarsadi Branch for an amount of Rs 9,16,833.16/- (Rupees Nine Lacs Sixteen Thousand Eight Hundred Thirty-Three and Paise Sixteen Only) as on 31.12.2023 in the said account together with costs and interestias aforesaid.

The borrower's/guarantor's/mortgagor's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem

**Description of immovable property** 

All that piece and parcel of immovable property bearing Plot No. 97 admeasuring area 40.15 sq. mtr. With margin land admeasuring 10.03 sq. mtrs. Of "L" type lots of "Paradise Park" along with undivided proportionate share in the land common road and COP of the said society situated on the land bearing Sub Block No. D of Block 119/A, Sub Block No. E of Block No. 119/C Revenue Survey No. 10 of Moje Village Palod, Taluka-Mangrol, District Surat. Date: 10/04/2024 **Authorised Office Union Bank Of India** Place : Surat

**IDFC FIRST Bank Limited** (erstwhile IDFC FIRST Limited and

amalgamated with IDFC Bank Limited) CIN: L65110TN2014PLC097792

Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

APPENDIX IV [Rule 8(1)] POSSESSION NOTICE (For immovable property) Whereas the undersigned being the Authorised Officer of the IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) unde ne Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Securit Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notic dated 17.02.2023 calling upon the borrower, co-borrowers and guarantors . Lakhaman Meragbhai Goria, 2. Hansaben Lakhamanbhai Goria, to repay the mount mentioned in the notice being Rs. 18,50,030.72/- (Rupees Eighteen Lac Fifty Thousand Thirty and Seventy Two Paise Only) as on 17.02.2023, within 60 days from he date of receipt of the said Demand notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowe and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him under sub – section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 n this 07th day of April 2024.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of THE IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank imited) for an amount of Rs. 18,50,030.72/- (Rupees Eighteen Lac Fifty Thousand Thirty and Seventy Two Paise Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub – Section (8) Of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

**Description of the Immovable Properties.** 

All That Piece Or Parcel Of Immovable Property Bearing Sub Plot No. 410/1, "Nidh Tution Classes". Having Area Admeasuring 56.00 Sq. Mtrs., Along With Constructio Admeasuring 69.32 Sq. Mt. Situated At Area Known As "Yogeshwardham" Revenue Survey No. 41/Paiki-2, Dhinchada, Jamnagar (Gujarat), And Bounded As

East: Plot No. 387 West: 7.50 Mt. Road North: Plot No. 409 South: Sub Plot No. 410/2

**Authorised Office** IDFC FIRST Bank Limited Date: 07th April 2024 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) Loan Account No: 51778944.

SHAH METACORP LIMITED (FORMERLY KNOWN AS GYSCOAL ALLOYS LIMITED)

Regd. Office: Plot No. 2/3 GIDC, Ubkhal, Kukarwada, Tal. Vijapur, Dist. Mehsana- 382830, Corporate Office: 2nd Floor, Mrudul Tower, B/h. Times of India, Ashram Road, Ahmedabad - 380 009. Phone: 079-26574878, mail: info@gyscoal.com CIN: L27209GJ1999PLC036656 Website: www.gyscoal.co CORRIGENDUMTO THE POSTAL BALLOT NOICE

This is with reference to the Postal Ballot Notice dated March 22, 2024 together witl Explanatory Statement in accordance with the applicable provisions of the Companies Act, 2013, the rules made thereunder ("the Act") and the Securities and Exchange Boarr of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations,"), Secretarial Standard on General Meetings ("SS-2") thereto, for seeking regulations), Secretarial Standard on General Meetings (SS-2) Interect, for seeking approval of members of the Company by way of Ordinaryl special resolutions through remote e-voting by way of postal ballot process. The Postal Ballot Notice has alread been circulated to all the Shareholders of the Company in due compliance with the provisions the Act and Listing Regulations. The Company through this corrigendum wishes to bring to the notice of the Shareholders, the Resolution No.5 along with explanator statement has been changed and resolution reconsidered and approved by th Committee of the Directors (as authorized by the Board in their original meeting date Committee of the Directors (as authorized by the Board in their original meeting date: 22.03.2024) approved the corrigendum Notice for the resolution No.5 and major changes includes: Heading and every were in Resolution and explanatory Statement:Replace as "Preferential issue and allotment of up to 12,88,45,746 equity shares in Consideration of cash to Non-Promoters and issue up to 14154254 Equity Shares by way of conversion of Loan to Non-Promoter (M/s. Sellwin Traders Limited) at an issue price of Rs. 4.02 [Rs of Loan to Non-Promoter (Mrs. 64.02 [Ks. 40.02 [Ks. 40. Instead of "Preferential issue and allotment of up to 20,90,00,000 (Twenty Crore Ninety Lakhs only) equity shares either in cash or/and conversion of Loan outstanding the books at the time of allotment to Non-Promoters and issue up to 4,85,00,000 convertible warrants into equity shares to Mona Viral Shah- Promoters (By conversion of Loan in to Equity or/and in cash) at an issue price of Rs.3.88 [Rs.1/- face value + Rs.2.88/- premium per share]" (2) Size of Issue and Price of the issue: Size of Issue changed from Rs. 99,91,00,000/- to 75,37,50,000 and Price of the issue changed from Rs.3.88 [Rs.1/- face value + Rs.2.88/- premium per share] to Rs. 4.02 per share [Rs. 1/- face value + Rs.3.02/- premium per share] (3) Relevant Date: changed to 28.03.2024 instead of 29.03.2024 (4) List of allottee: Numbers of allottees changed from 21 to 13 and following are not part of proposed allottees list: VEDANT RAKESH PANCHAL, SHANBHAI PANCHAL, KUNJANBEN RAKESH PANCHAL, AARYAMAN RAKESH PANCHAL, JAHNVI KATARMAL, LITTENDRA KALARMAL, DIPESH BHANUSHALI, SUNNY KATARMAL, Further, Company request the members to the Company who have JARNVI KATARMAL, JULENDRA KALARMAL, DIPESH BHANDSHALI, SUNNY KATARMAL Further, Company request the members to the Company who have already casted their Vote for Resolution No.5 and if they wish to change their Voting for Resolution No.5 then they may send email or communicate to Scrutiniser's to the Postal Ballot on office@kjatin.com and for any query may contact to NSDL or Company as per details given in Original Notice. This corrigendum to the Notice shall form an integral part of the Original Notice. Accordingly all the concerned Notice shall form an integral part of the Original Notice. Accordingly all the concerned members, stock exchanges, depositories, registrar, transfer agent and all stakeholder are requested to take note of revision/ modification. All other contents of the Postal Ballo Notice, save and except as modified or supplemented by this Corrigendum, shall remail unchanged (whole Resolution No.5 along with explanatory statement replaced). This corrigendum is available on the website of the company at www.gyscoal.com and is

By Order of the Board of Director, For, Shah Metacorp Limited (Formerly known as Gyscoal Alloys Limited sd/- **Hiral Patel**, Company Secretary

being communicated to stock exchange i.e. BSE Limited and National Stock Exchang of India Limited where the shares are listed.

15 days Legal Sale Notice to Borrowers, Gurantors and Mortgagers under Sarfaesi Act, 2002

Amroli Branch: Shop No.10-20, Escon Plaza Chanrabhatha Road Amroli Surat-394107 Guiara EMail: amroli@bankofbaroda.com

# 'ભ્રષ્ટાચાર સામેની લડાઈ અટકરો નહીં, ઇડીના માત્ર 3% કેસ રાજકારણીઓ વિરૂ

હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમ્યાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોઈપણ સ્તરે ભ્રષ્ટાચાર સમગ્ર દેશના લોકોને અસર કરે છે. વડાપ્રધાને કહ્યું કે ભ્રષ્ટાચારનો અંત એ તેમની પ્રાથમિકતા છે. વિરોધીઓ સામે ઇડીની કાર્યવાહીના આરોપો પર વડાપ્રધાને કહ્યું કે ઇડીના માત્ર ત્રણ ટકા કેસ રાજકારણ સાથે જોડાયેલા લોકો સામે ચાલી રહ્યા છે. તાજેતરના ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવશે. છેલા ૧૦ વર્ષમાં તેમની સરકારની સિલ્દિઓમાં, વડા પ્રધાને વિકાસ, સામાજિક કલ્યાણ કે ઇડીના માત્ર ત્રણ ટકા કેસ

'ઇડીના માત્ર ત્રણ ટકા કેસ રાજકારણ સાથે જોડાયેલા છે' વડાપ્રધાન મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે. વિરોધ પક્ષો સરકાર પર કેન્દ્રીય તપાસ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના લાભોની ગણતરી કરતા, એટલે કે

એજન્સીઓનો વિરોધીઓ વિરૂદ્ધ ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આના પર, વડા પ્રધાને આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા અને કહ્યું



ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ૧૦ કરોડ નકલી લાભાર્થીને હટાવ્યા : સરકારને ર.૭૫ લાખ કરોડની બચત

અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં કરેલા કાર્યોની યાદી આપી હતી. જમ્મ્-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને રામ મંદિર નિર્માણની પ્રધાને કહ્યું, 'જે રાજ્યોમાં ભાજપ સિધ્ધિઓનો પણ ઉદ્ઘેખ કર્યો.

'ભ્રષ્ટાચાર સહન નહીં કરીએ'

વડાપ્રધાને કહ્યું કે 'છેલા ૧૦ વર્ષમાં તેમની સરકારની પ્રાથમિકતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની રહી છે.' તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ભ્રષ્ટાચાર, ગમે તે સ્તરે, દેશના લોકોને અસર કરે છે. આવી સ્થિતિમાં દેશના લોકોના કલ્યાણ માટેના નાણાંની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. વડાપ્રધાને કહ્યું કે 'ભ્રષ્ટાચાર સામેની લડાઈ અટકશે નહીં.

રાજકારણ સાથે સંબંધિત છે. વડા સત્તામાં છે ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે આરોપો

રહ્યા છે જેમને પોતાની સામે તપાસનો ડર છે. વડા પ્રધાને કહ્યું કે '૨૦૧૪માં અમારી સરકાર બની કે તરત જ અમે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પગલાં લેવાનું શરૂ કર્યું. અમે સેન્ટ્રલ રિક્રુટમેન્ટમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીના ઈન્ટરવ્યુ પૂરા કર્યા. અમે દેશમાં ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે. અમે સરકારી સેવાઓને શક્ય તેટલી પારદર્શક

બનાવવાનો પ્રયાસ કર્યો છે. 'છેહ્યા ૧૦ વર્ષમાં ઇડીએ ૧ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ

જપ્ત કરી છે'

લોકોના બેંક ખાતામાં સીધા નાણાં મોકલવા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ડાયરેક્ટ બેનિફિટ ટ્રા<del>ન્</del>સફર એ ૧૦ કરોડથી વધુ નકલી

ગરીબ લોકોના કલ્યાણ માર્ટે ખર્ચવામાં આવ્યા હોત તો કેટલા લોકોને તેનો ફાયદો થયો હોત. યુવાનો માટે કેટલી તકો ઊભી કરી શકાઈ હોત. કેટલા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા હોત.

વડાપ્રધાને કહ્યું ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો અસલી તફાવત

ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત સમજાવતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપ દેશને મજબૂત કરે છે, જ્યારે કોંગ્રેસ માત્ર પરિવાર પર ધ્યાન આપે છે. તેમણે કહ્યું કે પહેલીવાર લોકોને બીજેપી મોડલ અને કોંગ્રેસ મોડલની સરખામણી કરવાની તક મળી છે. કોંગ્રેસે સંપૂર્ણ બહુમતી

## છેક્ષા ૧૦ વર્ષમાં જે કર્યું તે માત્ર ટ્રેલર છે, હજુ દેશને ઘણો આગળ લઈ જવાનો છે

લાભાર્થીઓને દૂર કરવામાં સરકારને મદદ કરી છે. સરકારે આનાથી ૨.૭૫ લાખ કરોડ રૂપિયા બચાવ્યા

લગાવવામાં આવી રહ્યા છે તે એવા લોકો દ્વારા જ લગાવવામાં આવી છે, જે ખોટા હાથમાં જઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, '૨૦૧૪ પહેલા ઇડીએ ૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં ઇડી દ્વારા જપ્ત કરાયેલી રકમ વધીને ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ૨૦૧૪ પહેલા ઇડીએ ૩૪ લાખ રૂપિયાની રોકડ જપ્તે કરી હતી, જ્યારે અમારી સરકારમાં ૨૨૦૦ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. વિચારો, જો આ પૈસા

સાથે ૫-૬ દાયકા સુધી દેશમાં શાસન કર્યું. તે જ સમયે, ભાજપે પૂર્ણ બહ્મતી સાથે શાસને કર્યાને માત્ર એક દાયકા જ પસાર થયા છે. જ્યારે કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતીની સરકાર હતી ત્યારે તેઓએ પરિવારને મજબૂત બનાવ્યો હતો, જ્યારે અમારી બહુમતી સરકારમાં અમારી પ્રાથમિકતા દેશ, ગામડાઓ, ગરીબો, મધ્યમ વર્ગ અને ખેડૂતોને મજબૂત કરવાની છે. તેમની સરકારના વિઝન વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ગરીબી દૂર કરવા, સ્વચ્છતા વધારવા અને ગરીબોને ઘર આપવા પર ધ્યાન આપવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે. દેશને

## ખેંગ્લોર કાફે બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ સહિત બેની કોલકતાથી ધરપકડ

દેશના આઈટી પાટનગર બેંગ્લોરમાં થયેલા રામેશ્વર કાફ્રે બ્લાસ્ટમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મોટી સફળતા મળી છે અને આ

એનઆઈએ ને જબરી સફળતાઃ વિસ્ફોટક મુકનાર પણ ઝડપાઈ ગયો

માસ્ટરમાઈન્ડ બ્લાસ્ટના અબ્દુલમથીન તાહા સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે. એનઆઈએની ટીમે આ બંનેને કોલકતામાંથી દબોચી લીધા હતા અને તેમને હવે બેંગ્લોર લઈ આવીને અદાલત સમક્ષ રજુ કરાશે. જે બંનેને ધરપકડ કરાયા છે તેમાં કાફેમાં

વિસ્ફોટક રાખનાર આરોપી મુસાવીર હુસેન શાબીદ અને આ ષડયંત્ર રચનાર માસ્ટરમાઈન્ડ અબ્દુલમથીન તાંહા તરીકે ઓળખ થઈ છે.

૧ માર્ચના રોજ બેંગ્લોરના આ કાફેમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો જેમાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ વિસ્ફોટનું ષડયંત્ર રચનાર છેક કોલકતામાં બેઠો હતો અને તેણે તામિલનાડુના એક યુવકને સાધીને આ વિસ્ફોટનું ષડયંત્ર રચ્યું હતું.



દેશમાં લોકસભાની યોજાઇ રહેલી સામાન્ય ચૂંટણીને લઇને મતદાન માટે મતદારોમાં જાગૃતિ અર્થે પંજાબના શહેર અમૃતસરમાં જલિયાવાલા શહીદ સ્મારક ખાતે વિદ્યાર્થીઓ વિશાળ રંગોળી બનાવી રહ્યા છે.

# જયારે ઈન્દિરા ગાંધીની સામે સિંહ સાથે પહોંચ્યો બળવાખોર નેતાઃ રસપ્રદ વાત

આગળ લઈ જવાનો છે.

નેતા બિહારી સિંહ વિશાળ ભીડ વચ્ચે સિંહ સાથે પહોંચ્યા હતા. બળવાખોર કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા બિહારી સિંહ નારાજ હતા. તેમણે ઈન્દિરા ગાંધીને જાહેર સભાઓને સંબોધિત ન કરવાની ચેતવણી આપી

દાદરીમાં ઈન્દિરા ગાંધીના ગાંધી જાહેર સભાને સંબોધવાના રામચંદ્ર વિકલના સમર્થનમાં જાહેર સભા યોજાવાની હતી. તે જ સમયે ટિકિટ ન મળવાથી નારાજ બિહારી

દિલ્હી, તા ૧૨ સિંહે કોંગ્રેસ સામે બળવો કર્યો અને ગાઝિયાબાદના સર્કસમાંથી ૫૦૦ વર્ષ ૧૯૭૪માં ઈન્દિરા ગાંધીની અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં જાહેર સભામાં નાસભાગ મચી ગઈ ઉતર્યા. તેમને સિંહનું ચૂંટણી ચિદ્ધ હતી જ્યારે કોંગ્રેસના બળવાખોર ફાળવવામાં આવ્યું હતું. તેમણે

સિંહને સર્કસમાંથી

૫૦૦ રૂપિયામાં

લઈ આવ્યા હતા હતી. તેમના આ પગલાને કારણે ઈન્દિરા ગાંધીને ચૂંટણી રેલીને ઈન્દિરા ગાંધીએ જાહેર સભા સંબોધવા માટે દાદરી ન આવવા અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. જણાવ્યું હતું. આમ છતાં ઈન્દિરા

પોતાના નિર્ણય પર અડગ રહ્યા.

રૂપિયા આપીને ભાડા પર સિંહ લાવ્યા હતા. તેઓએ સિંહને તેના પાંજરામાં આખી રાત ઢાંકીને આંગણામાં રાખ્યો હતો. બીજા દિવસે જ્યારે ઈન્દિરા ગાંધી રેલી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ પણ સિંહના પાંજરાને લઈને ત્યાં પહોંચ્યા હતા.અસલી સિંહને જોયા બાદ ત્યાં એક અફવા ફેલાઈ કે બિહારી સિંહ સિંહને

પાંજરામાંથી છોડાવવા જઈ રહ્યા છે. આ પછી નાસભાગ મચી ગઈ હતી અને રેલી સ્થળ પર એકઠા થયેલા લોકો ભાગી ગયા હતા. ભીડ વિખેરાઈ ગયા બાદ ઈન્દિરા જાહેર સભાના એક દિવસ ગાંધી પણ પાંચ મિનિટમાં જ પહેલા બિહારી સિંહ બાગી સભામાંથી નીકળી ગયા હતા.

એલન મસ્કના

ભારત આગમન

પુર્વે સ્પર્ધા

## હવે भी ग જેવા જ ફાઈટર मनीष सीसोदीयाओ विभानो सारतमां अनुशे माटे अभीन मूर्ं यू

હિન્દુસ્તાન એરોનોટીસ લી.ને હવાઈદળ તરફથી વિમાનોનો ઓર્ડર મળ્યો

દેશમાં સંરક્ષણ તંત્ર આત્મનિર્ભર બનવાની દૌટમાં હવે સરકારી સાહસની કંપની હિન્દુસ્તાન એરોનોટીકલ લી.ને એલસીએ માર્કના ૯૭ ભારતીય હવાઈદળ માટે એલસીઈ નાર્કના ૯૭ ફાઈટર વિમાનો માટે ઓર્ડર આપ્યા છે અને આ વિમાન હવાઈદળએ મીગ-૨૧, મીગ-૨૩ અને મીગ-૨૭ વિમાનોનું સ્થાન

લેશે. રૂા. ૬૫૦૦૦ કરોડનું આ ટેન્કર સ્વીકારવા મુદ્દે હિન્દુસ્તાન એરોનેટીવ લી.ને ત્રણ પાસ અપાયો છે. સ્વદેશી મીલીટ્રી હાર્ડવેર યોજના હેઠળ આ ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની હિન્દુસ્તાન એરોનોટીકલ સાથે જોડાયેલી નાની અને મધ્યમ કદની કંપનીઓને પણ ફાયદો થશે. હિન્દુસ્તાન એરોનોટીકલ લી. ને અગાઉ એલસીએ માર્કનું એક વિમાન તૈયાર કરીને તે હવાઈદળને આપ્યુ હતું જે તમામ કસોટીમાં પાર પડયું છે પણ હવે તેની ઉત્પાદન ક્ષમતા તેના માટે વધારવી પડશે.

# યુંટ્ણીમાં પ્રચાર કરવા

ગત વર્ષે ફેબ્રુઆરી માસની જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ફરી એક વખત વચગાળાની જામીન અરજી કરી છે. તેઓએ લોકસભા ચુંટણી પ્રચાર માટે જામીન માંગ્યા છે. દિલ્હીની ટ્રાયલ કોર્ટે સમક્ષ તેઓએ સીબીઆઈ તથા ઈડી બન્ને એ તેમની સામે જે કેસ દાખલ કર્યા છે. તેમાં જામીન માંગ્યા છે. હાલ તેમાં ૧૫ એપ્રિલ સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં છે. 'આપ'ના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ

વાઘા બોર્ડર પર ભારતીય દર્શકોની સંખ્યા વધીઃ પાકિસ્તાન ખાલીખમ નવી દિલ્હીઃ

ભારત-પાકિસ્તાન વાયા બોર્ડરનું નામ સાંભળતાની સાથે જ ભારત તરફથી BSF અને પાકિસ્તાનના રેન્જર્સની ઉત્સાહપૂર્ણ પરેડનું દ્રશ્ય તેમના મગજમાં તરવરવા લાગે છે. સરહદ પર દરરોજ સાંજે યોજાતા આ બીટીંગ-ધ-રીટ્રીટ બોર્ડર સેરેમનીમાં ભારત તરફથી ભારત માતા કી જય... હિન્દુસ્તાન ઝિંદાબાદ... વંદે માતરમના નારા લગાવવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન તરફથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવે છે. . જો કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તરફથી ઉત્સાહમાં ઘટાડો જોવા મળી કેજરીવાલ હાલ જેલમાં છે

પર પરેડ જોવા માટે જગ્યા ઓછી હતી. પછી પરેડ નિહાળવા અહીં

બેઠક વ્યવસ્થામાં વધારો કર્યોઃ દરરોજ ૨૦ થી ૨૧ હજાર દર્શકોનો પરેડ નિહાળવા ધસારો

આવનારાઓ માટે બેઠક ક્ષમતા વધારવી પડી. હાલમાં લગભગ ૧૭ હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે. ભારતીયોમાં દેશભક્તિની ભાવના એટલી હદે વધી રહી છે કે દરરોજ બીએસએફ અધિકારીઓનું કહેવું પ્રેક્ષકોની બેઠક ક્ષમતા માત્ર ભરેલી નથી

પણ પહોંચી જાય છે. પાકિસ્તાન તરફની બેઠક ક્ષમતા પહેલાથી જ ઓછી છે. અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાન ભારતીય સેનાએ પેવેલિયનની. તરફથી માત્ર ૧ હજાર લોકો જ બેસી શકે છે અને હવે તેમાંથી અડધાથી વધુ જગ્યા ખાલી રહે છે.

એક સમય હતો જ્યારે ભારત અને પાકિસ્તાનથી લગભગ સમાન સંખ્યામાં લોકો આવતા હતા. બંને તરફથી ભારે સુત્રોચ્ચાર થયા હતા. હવે ભારતીય બાજુથી લોકો વધી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન તરફથી ઘણી વખત ૫૦૦ અથવા તેનાથી પણ ઓછા પાકિસ્તાનીઓ પરેડ જોવા માટે આવી

### નામ બદલેલ છે

મેં મારું જૂનું નામ પટેલ શિવાનીબેન પ્રજ્ઞેશકુમાર હતું તે બદલીને નવું નામ પટેલ શિવાની પ્રજ્ઞેશકુમાર રાખેલ છે. મુકામ-ક્ષરઢવ ૧૬૮૨ રખેવાળ નવો વાસ જી-ગાંધીનગર-૩૮૨૬૪૦

#### નામ બદલેલ છે

મેં મારું જૂનું નામ પટેલ શિવાની હતું તે બદલીને નવું નામ પટેલ શિવાની પ્રજ્ઞેશકુમાર રાખેલ છે. મુકામ-સરઢવ ૧૬૮૨ રખેવાળ નવો વાસ જી-ગાંધીનગર-૩૮૨૬૪૦

## નામ બદલેલ છે

જૂનું નામ/અટક કમલેશ ચૌધરી (CHOUDHARY) બદલીને નવું કમલેશ ચૌધરી (CHAUDHARY) રાખેલ છે. સરનામુંઃ સી-૪૦૪, કે.બી. રોયલ અલતીઝા, ચાંદખેડા, ત્રાગડ ગામ, અમદાવાદ-૩૮૨૪૨૪

#### અટક બદલેલ છે

જૂનું નામ સંજયકુમાર મોહનભાઈ ેરબારી નવું નામ સંજયકુમાર મોહનભાઈ દેસાઈ સરનામુંઃ ૧૭-બી, મોરારજી પાર્ક સોસાયટી, જીવરાજ પાર્ક, અમદાવાદ

#### અટક બદલેલ છે

જૂનું નામ નીતાબહેન સંજયકુમાર રબારી નવું નામ નીતાબહેન સંજયકુમાર દેસાઈ સરનામું: ૧૭-બી, મોરારજીપાર્ક સોસાયટી, જીવરાજ પાર્ક, અમદાવાદ

## ટેસ્લાનો પ્લાંટ મેળવવા ગુજરાત સાથે હરિફાઈમાં ઉતરતું તામિલનાડુ

નવી દિલ્હીઃ આગામી તા.૨૨ના રોજ ટેસ્લા કંપનીના વડા અને જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્ક આવી રહ્યા છે અને તેઓ ભારતમાં ટેસ્લાનો ઉત્પાદન પ્લાંટ સ્થાપવા

મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજવાના છે.

પ્રતિષ્ઠિત પ્લાંટ મેળવવા ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર વચ્ચે સ્પર્ધા

શરુ થઈ છે અને તામિલનાડુએ ચેન્નઈને ભારતના ડેટ્રોઈટ તરીકે ગણાવતા કહ્યું કે ટેસ્લાનો પ્લાંટ મેળવવા રાજય સરકાર મસ્કને શ્રેષ્ઠ ઓફર કરશે. ટેસ્લાના અધિકારીઓની ટીમ ભારત આવી છે અને તેમાં સંભવિત સ્થળ અંગે પ્રયાસ કરી રહી છે.

ગુજરાત સરકારે પણ ટેસ્લાનો પ્લાંટ મેળવવા માટે તૈયારી કરી છે. ચેન્નઈમાં નિશાન મોટર્સ, રેનોલ્ટ, હુંડાઈ અને બીએમડબલ્યુ એ-જીના ઉત્પાદન પ્લાંટ ધરાવે છે અને અહી ઓટો સ્પેર યુનિટ પણ મોટી સંખ્યામાં આવેલ છે.

#### શાહ મેટાકોર્પ લિમિટેડ (અગાઉ જીસ્કોલ એલોય લિમિટેડ તરીકે જાણીતું)

રજીસ્ટર્ડ ઑફિસ : પ્લોટ નંબર ૨/૩, જીઆઈડીસી, ઉભલ, કુંકરવાડા, તા. વિજાપુર, જિ. મહેસાણા-૩૮ ૨૮૩૦, કોર્પોરેટ ઓફિસ: બીજો માળ મૃદુલ ટાવર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ -૩૮૦ ૦૦૯.Phone: 079-26574878, Email: info@gyscoal.com CIN: L27209GJ1999PLC036656 Website: www.gyscoal.com

#### પોસ્ટલ બેલેટની નોટિસમાં સુધારો

કંપની અધિનિયમ, ૨૦૧૩, તેના હેઠળ બનાવેલા નિયમો ("અધિનિયમ") અને સિક્થોરિટીંગ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ અને ડિસ્ક્લોઝર જરૂરીયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ("લિસ્ટિંગ રેગ્યુલેશન્સ"), સેકેટરીયલ સ્ટાન્ડર્ડ ઓન જનરલ મીટિંગ્સ ("ss-2"), રિમોટ ઇ-વોટિંગ દ્વારા સામાન્ય/ વિશેષ દરાવો ની કંપનીના સભ્યોની મંજૂરી મેળવવા માટે પોસ્ટલ બેલેટ પ્રક્રિયા વોટિંગ દ્વારા. પોસ્ટલ બેલેટ નોટિસ કંપનીના તમામ શેરધારકોને પહેલેથી જ નિયમ અને લિસ્ટિંગ રેગ્યુલેશન્સની જોગવાઈઓનું પાલન કરીને મોકલવામાં આવી છે. કંપની આ સુધારા દ્વારા શેરધારકોના ધ્યાન પર લાવવા ઈચ્છે છે, ઠરાવ નંબર પ અને છે. કંપના આ સુધારા દ્વારા શરચારકાના ધ્યાન પર લાવવા ઇચ્છ છે, ઠરાવ નબર પે અને સ્પષ્ટતાત્મક નિવેદનમાં કેરફાર કરવામાં આવ્યો છે અને ઠરાવની પુનઃવિચારણા કરવામાં આવી છે અને તિદેશકોની સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી છે (જેમ કે બોર્ડ દ્વારા તેમની મૂળ મીટિંગ તારીખ ર ર.૦૩.૨૦૦૪માં અધિકૃત કરવામાં આવી છે) ઠરાવ નંબર પ માટે સુધારાત્મક સૂચનાને મંજૂર કરવામાં આવી છે અને મુખ્ય ફેરફારોમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ મથાળા અને દરેક રિઝોલ્યુશન અને ખુલાસાત્મક નિવેદનઃ "પ્રેકરન્શિયલ ઇશ્યૂ તરીકે બદલાયેલ છે અને બિન-પ્રમોટરાને રોક્કર્ની વિચારણામાં ૧૨,૮૮,૪૫,૭૪૬ ઇક્વિટી શેરની કાળવણી અને ૧૪૧૫૪૨૫૪ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે લોનના રૂપાંતર દ્વારા બિન-પ્રમોટર (મેસર્સ સેલીવન ૧૪૧૫૪૨૫૪ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે લોનના રૂપાંતર દ્વારા બિન-પ્રમોટર (મેસર્સ સેલીવન ૧૪૧૫૪૨૫૪ ઇક્વિટી શર્જા છે. ક્લિટી શેર્સ કર્યા કરાય કરાય કરાય કરાયો કર્યા કરાયો કરાયો કરાયો કર્યા કરાયો કર્યા કરાયો કર્યા કરાયો કરા ૧૪૧૫૪ ૨૫૪ ઇોક્વટી શર ઇશ્યૂ કરવા માટે લાનના રૂપાતર દ્વારા બિન-પ્રમાટર (મસસ સલાવન ટ્રેડર્સ લિમિટેડ) રૂા. ૪.૦૨ની ઇશ્યૂ કિંમતે (રૂા. ૧/- ફેસ વેલ્યુ + રૂા. ૩.૦૨/- પ્રીમિયમપ્રતિ શેર] અને સુશ્રી મોનાને ઇક્વિટી શેરમાં ૪,૪૫,૦૦,૦૦૦ સુધીના કન્વર્ટિબલ વોરંટ ઇશ્યૂ કરો. વિરલ શાહ- પ્રમોટર ડાયરેક્ટર (જેમાંથી ૨૯૮૫૦૭૪૬ સુધીનું કન્વર્ટિબલ વોરંટ આઉટસ્ટેન્ડિંગ અસુરક્ષિત લોનના રૂપાંતર દ્વારા ઇક્વિટી શેરમાં અને બાકીનું ૧,૪૬,૪૯,૨૫૪ કન્વર્ટિબલ વોરંટ રોકડમાં ઇશ્યૂ કિંમતે. ૪.૦૨ પ્રતિ શેરારૂા. ૧/- ફેસ વેલ્યુ + રૂા. ૩.૦૨/- શેર દીઠ પ્રીમિયમા "પ્રેક્રનિશયલ ઇશ્યૂ અને ફાળવણીના સમયે ૨૦,૯૦,૦૦,૦૦૦ (માત્ર વીસ કરોડ નેવું લાખ) સુધીના ઇક્વિટી શેરની ફાળવણીને બદલે રોકડમાં અથવા/અને લોનની બાકી રહેલી રકમનું સુધીના ઇક્વિટી શરની ફાળવણીન બદલ રોકડમાં અથવા અને લોનની બાકી રહેલી રકમનું રૂપાંતર ફાળવણી સમયે બુકમાં નોન-પ્રમોટર્સ માટે અને મોના વિરલ શાહને ઇક્વિટી શેરમાં ૪,૮૫,૦૦,૦૦૦ સુધી કન્વટિંબલ વોરંટ ઇશ્યૂ કરો- પ્રમોટર્સ (લોનનું ઇક્વિટી અથવા)અને રોકડમાં રૂપાંતર કરીને) રૂ. ૩.૮૮ (રૂા. ૧/- ફેસ વેલ્યુ + રૂા. ૨.૮૮/- પ્રીમિયમ પ્રતિ શેર શી રૂા. ૪.૦૨ પ્રતિ શેર રૂા. ૧/- ફેસ વેલ્યુ + રૂ. ૩.૦૨/- પ્રીમિયમ પ્રતિ શેર (રૂ). સંબંધિત તારીખ: ૨૯.૦૩.૨૦૨૪ ના બદલે ૨૮.૦૩.૨૦૨૪ કરવામાં આવી (૪) ફાળવણીની સૂચિ: ફાળવણીની સંખ્યા ૨૧ થી ૧૩ માં બદલાઈ અને નીચેના સૂચિત ફાળવણીઓની સૂચિનો ભાગ નથી: વેદાંત રાકેશ પંચાલ, કૃષ્ણભંજન રાકેશ પંચાલ, આર્યમન રાકેશ પંચાલ, જાલવી કટારમલ, જિતેન્દ્ર કલારમલ, દિપેશ ભાનુશાલી, સસી કટારમલ, વધુમાં, કંપની એવા સભ્યોને વિનંતી કરે છે કે જેમણે પહેલેથી જ કટાવ નંબર ૫ માટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર ૫ માટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર ૫ માટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્યાર્થ માટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પોતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પાતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પાતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પાતાનો વોટ આપ્યો છે અને જો તેઓ કરાય લંબર પ્રમાટે પાતાનો વોટ આપ્યો છે સ્થાન સ્થા શ્રી કરાય સ્થા સ્થાન પ માટેના તેમના વોટિંગમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેઓ office@kjatin.com પર પોસ્ટલ બેલેટ પર સ્કુટીનાઈઝરને ઈમેઇલ મોકલી શકે છે અથવા વાતચીત કરી શકે છે અને કોઈપણ પ્રશ્ન માટે મૂળ નોટિસમાં આપવામાં આવેલી વિગતો મુજબ એનએસડીએલ અથવા કંપનીનો સંપર્ક કરી શકે છે. મૂળ નોટિસ તદનુસાર તમામ સંબંધિત સભ્યો, સ્ટોક એક્સચેન્જો ડિપોઝિટરીઝ, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ અને તમામ હિતધારકોને પુનરાવર્તન/સુધારણાની નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ નોટિસની અન્ય તમામ વિગતોઓ, આ સુધારા દ્વારા સંશોધિત અથવા પૂરક સિવાય યથાવત રહેશે. (સમગ્ર રીઝોલ્યુશન નંબર પ સાથે ખુલાસાત્મા નિવેદન બદલાઈ ગયું). આ સુધારણા કંપનીની વેબસાઈટwww.gyscoal.com પર ઉપલબ્ધ છે અને સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડને જાણ કરવામાં આવી રહી છે જ્યાં શેર યાદી થયેલ છે.

બોર્ડ ઓફ ડિરેક્ટરના આદેશથી, શાહ મેટાકોર્પ લિમિટેડ માટે તારીખઃ ૧૨-૦૪-૨૦૨૪ (અગાઉ જીસ્કોલ એલોય લિમિટેડ તરીકે જાણીતું) sd/- **હિરલ પટેલ,** કંપની સેક્રેટરી

## સંસદમાં પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો

# મંદિરો પર વધતા હુમલાથી ભારતીય મૂળના અમેરિકન સાસંદો નારાજ

ભારત સહિતના બીજા દેશોના મામલાઓમાં માથુ મારતા અમેરિકાને તેના જ દેશના સાંસદોએ સંસદની અંદર અરીસો બતાવ્યો છે. અમેરિકાની સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કરાયો છે અને તેમાં અમેરિકામાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલા સામે નારાજગી વ્યક્ત કરાઈ છે. આ પ્રસ્તાવને ભારતીય મૂળના કોંગ્રેસ મેન શ્રી થાનેદારે સંસદ સમક્ષ રજૂ કર્યો છે. આ પહેલા પણ ભારતીય મૂળના સાંસદોએ અમેરિકાના કાયદા મંત્રાલયને એક પત્ર લખીને હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલામાં શું કાર્યવાહી થઈ તેનો જવાબ માંગ્યો હતો.

સંસદમાં રજૂ થયેલા પ્રસ્તાવમાં કહેવાયુ છે કે,

સમુદાયનુ બહુ મોટુ યોગદાન છે. આમ છતા હિન્દુઓને અમેરિકામાં પક્ષપાતનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલો અને કોલેજોમાં હિન્દુ

## આ પ્રસ્તાવને ભારતીય મૂળના કોંગ્રેસ મેન શ્રી થાનેદારે રજૂ કર્યો

વિદ્યાર્થીઓનુ અપમાન કરાય છે, તેમની સાથે પક્ષપાત કરાય છે અને તેમને હેટ ક્રાઈમનો ભોગ બનવાનો વારો આવે છે. અમેરિકામાં હિન્દુઓ સામે નફરતની અને મંદિરો પર હુમલાઓની ઘટનાઓ વધી છે. અમેરિકામાં આજે ૪૦ લાખ હિન્દુઓ રહે છે અને

પોતાનુ યોગદાન આપી રહ્યા છે. આમ છતા તેઓ હિન્દુ ફોબિયાનો શિકાર બની રહ્યા

સંસદમાં રજૂ થયેલા કાયદા

પહેલા ૨૯ માર્ચે ભારતીય મૂળના પાંચ સાંસદોએ ભારતની સરકારને પત્ર લખીને હિન્દુ મંદિરો પર થયેલા હુમલાની તપાસની જાણકારી અમેરિકન સરકાર પાસે માંગી હતી. આ પત્રમાં કહેવાયુ હતુ કે, ન્યયોર્કથી કેલિફોર્નિયા સુધી મંદિરો પર એટેક કરવામાં આવ્યા છે અને તેના કારણે હિન્દુ સમુદાયમાં ગભરાટનો માહોલ છે. આ હુમલાની તપાસમાં અમેરિકન એજન્સીઓની ઢીલી નીતિની સામે પણ આ સાંસદોએ નારાજગી વ્યક્ત કરી હતી.

### બીઆરએસ નેતાને ઝટકો

## કવિતાને કોર્ટે ૧૫ એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યા

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ૧૫ એપ્રિલ્, ૨૦૨૪ સુધી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. કોર્ટે શુક્રવારે (૧૨ એપ્રિલ, ૨૦૨૪) કે. કવિતાને પાંચ દિવસની કસ્ટડી આપવાની વિનંતી કરતી CBIની અરજી પરનો આદેશ સાંજ સુધી અનામત રાખવામાં આવ્યો હતો.CBIએ દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કવિતાની ધરપકડ કરી છે. CBI દ્વારા કવિતાને ગુનાહિત ષડયંત્ર અને ખાતાઓમાં હેરાફેરી અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કેટલીક કલમો હેઠળ અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઈએ કોર્ટમાં બીઆરએસ નેતાના પ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

## મોદીએ હીટવેવ અને ચોમાસાને લઇને થતી તૈયારીઓની કરી સમીક્ષા

હવામાન અંગે, IMD અને NDMAએ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. હવામાનને લગતી આગાહીના પગલે હીટવેવ (લૂ), ચોમાસુ અને આરોગ્ય ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બે મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી અને

વડાપ્રધાને હીટવેવ અને ચોમાસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.વડાપ્રધાન મોદીએ અધિકારીઓને હીટવેવનો સામનો કરવા, હોસ્પિટલોની સજ્જતા જાળવવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રાલય અને એનડીએમએની સલાહ પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું









